

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રમ્પટન, પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ, જેઝ કેર ફાઉન્ડેશન યોજે છે ફિલ્ડ ઓફ ડ્રીમ્સ એક્સેસિબલ બેઝબોલ ડાયમંડના ઉદ્ઘાટનનો મહાસમારોહ

બ્રમ્પટનનું સૌપ્રથમ સંપૂર્ણપણે સુલભ્ય બેઝબોલ ડાયમંડ જે સમુદાયના ઉપયોગ માટે તૈયાર છે.



બ્રમ્પટન, ઓન્ટારિયો (29 એપ્રિલ 2022) – આજે સીટી ઓફ બ્રમ્પટન, પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ (PDSB), જેઝ કેર ફાઉન્ડેશનના પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ અને સીટી ઓફ બ્રમ્પટન ફિલ્ડ ઓફ ડ્રીમ્સ એક્સેસિબલ બેઝબોલ ડાયમંડના ઉદ્ઘાટનના મહાસમારોહના પ્રસંગે સમુદાય ભેગો થયો હતો. તે ફિલ્ડ જે ડિસેમ્બર 2021માં પૂર્ણ થયું તે હવે સમુદાયના ઉપયોગ માટે તૈયાર છે.

2020માં જેઝ કેર ફાઉન્ડેશન ફિલ્ડ ઓફ ડ્રીમ્સના કેનેડાના અનુદાનના 12 પ્રાપ્તકર્તાઓ પૈકી બ્રેમ્પટન એક છે. આ અનુદાન બાળકો અને યુવાનો બેઝબોલ રમી શકે તે માટે અને નિરોગી તથા સક્રિય રહી શકે અને જીવનોપયોગી કૌશલ્યો શીખી શકે તે માટે ડિઝાઇન સમારકામ કરીને નવીન કરવા માટે અને તેમને માટે સુગમ સ્થળો માટે ભંડોળ પૂરું પાડે છે. આ પરિયોજના માટે સિટી ઓફ બ્રેમ્પટને એક તૃતીયાંશ ભંડોળ પૂરું પાડ્યું હતું, PDSB નીધિયન દ્વારા બીજું એક તૃતીયાંશ અને ખર્ચનો બાકી રહેલ ત્રીજો ભાગ જેઝ કેર ફાઉન્ડેશન (Jays Care Foundation) અનુદાન દ્વારા પૂરો પાડવામાં આવ્યો.

બ્રેમ્પટન ખાતે પહેલવહેલી વખત એવું ફિલ્ડ ઓફ ડ્રીમ્સ તે જુડીથ નાયમેન સેકન્ડરી સ્કૂલ અને વિલિયમ્સ પાર્કવે સિનિયર પબ્લિક સ્કૂલ વચ્ચેની હરિયાળી જગ્યામાં આ એક ઉત્કૃષ્ટ ઉમેરો છે. 1305 વિલિયમ્સ પાર્કવે પર સ્થિત બેઝબોલ ડાયમંડ ચિંગકુઝી સેકન્ડરી સ્કૂલની એટલી પાસે છે કે ત્યાંના વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકશે અને ત્યાંથી હાઈવે 410 પણ સુગમ છે તેથી તમામ બ્રેમ્પટનવાસીઓ માટે આ સાઈટ અનુકૂળ છે. આ પ્રોજેક્ટ પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ અને સિટી ઓફ બ્રેમ્પટન વચ્ચેની જાહેર ભાગીદારીનો જોરદાર નમૂનો છે જેનાથી આખા બ્રેમ્પટન ફરતેના વિદ્યાર્થીઓ તેમજ રહેવાસીઓ માટેની મનોરંજન સવલતોની સુગમતામાં વધારો થશે, અને એવી આશા રાખવામાં આવે છે કે તેનો બોર્ડ તેમજ ચેલેન્જર બેઝબોલ અને સ્પેશ્યલ ઓલિમ્પિક્સ દ્વારા સારો એવો ઉપયોગ થશે.

નવું ફિલ્ડ ઓફ ડ્રીમ્સ નોંધપાત્ર સુલભતા અને કાર્યક્ષમતા ધરાવે છે: આર્ટિફિશિયલ ટર્ફ ઈનફિલ્ડ, સુધારેલ બેઝ પાથ (60'); ટૂંકુ આઉટફિલ્ડ, કોઈ ગ્રેડ પરિવર્તન વિનાનો સુધારેલ પિચર્સ માઉન્ડ; રમતવીરો માટે સુલભ બેન્ચ એરિયા અને, ફિલ્ડ પર જવા માટેના કોંક્રીટના એક્સેસ પાથવે. આઉટફિલ્ડ કુદરતી ઘાસનું બનેલું છે અને વોર્નિંગ ટ્રેક હાર્ડ-પેકડ કાંકરીથી બનેલો છે.

ટેરી મિલર રિક્રિએશન સેન્ટર પાર્કિંગ લોટમાં એક્સેસિબલ રેમ્પ અને પાર્કિંગ લોટ્સ તે લોકો માટે બનાવવામાં આવ્યા છે જેઓ ફિલ્ડ ઓફ ડ્રીમ્સનો ઉપયોગ કરતા હોય. બેઝબોલ ડાયમંડની અન્ય સવલતોમાં સામેલ છે: હોમ પ્લેટની પાછળ ચાહકોને બેસવા માટે બિલ્યર બેઠક વ્યવસ્થા; અલગ અલગ યુઝર ગ્રૂપ માટે ચાર પિચર માઉન્ડ્સ; અને એક આઉટફિલ્ડ ફેન્સ જે હોમ પ્લેટથી માત્ર 225 ફૂટની દૂરી પર હોય.

ફિલ્ડ ઓફ ડ્રીમ્સ બેઝબોલ ડાયમંડ બૂક કરવા માટે જે રહેવાસીઓ, સ્પોર્ટ્સ ગ્રૂપ્સ અને સામાજિક સંસ્થાઓને અંતરાય મુક્ત સવલતોની આવશ્યકતા હોય તેઓ સિટીના સ્પોર્ટ્સ ફિલ્ડ રેન્ટલ્સ એકમનો સંપર્ક 905-874-BOOK (2665) પર કરી શકે અથવા અહીં ઈમેલ કરી શકે facilityrentals@brampton.ca.

પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ વિષયક

પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ (PDSB) વંશીય, સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે વૈવિધ્યસભર બોર્ડ છે જે બ્રેમ્પટન, કેલેડન અને મિસિસોગાની 259 શાળાઓમાં 155,000 કરતા વધુ વિદ્યાર્થીઓને સેવા આપે છે. PDSB કેનેડાની બીજી સૌથી મોટી શાળા તેમજ પીલ રિજનમાં સૌથી મોટા નિયોક્તા છે. વધુ જાણવા માટે www.peelschools.org.

જેઝ કેર ફાઉન્ડેશન વિશે

જેઝ કેર ફાઉન્ડેશન, જે ટોરોન્ટો બ્લૂ જેઝની સખાવતી શાખા છે તેઓ બેઝબોલનો ઉપયોગ જીવન કૌશલ્યો શીખવવાના તેમજ કેનેડા ફરતેના 35,000 કરતા વધુ બાળકો અને યુવાનોના ટકાઉ સામાજિક પરિવર્તન આણવાના ટૂલ તરીકે કરે છે. જેઝ કેર ગૌરવ લે છે કે તેઓ તમામ દસ પ્રાંતોમાં અને બે પ્રદેશોમાં કાર્ય કરે છે જેઓ કેનેડિયન બાળકો જેઓ અવરોધોનો સામનો કરતા હોય તેમના માટે રમતના ક્ષેત્રમાં સમાનતા

લાવવા માટે સમુદાયલક્ષી કાર્યક્રમો ચલાવે છે. સંસ્થાએ 100 કરતા વધુ ડાયમંડો અને રિક્રિએશનની જગ્યાઓના બાંધકામ અને સમારકામને ટેકો આપવા માટે ફિલ્ડ ઓફ ડ્રીમ્સના માધ્યમથી \$10 મિલિયન કરતા વધુ રકમનું રોકાણ કર્યું છે. 2020 માં જેઝ કેરને MLBનું એલન એચ સેલિંગ પારિતોષિક એનાયત થયું હતું જે સખાવતી ઉત્કૃષ્ટતા માટે \$7.5 મિલિયનના કોવિડ-19ની જવાબી કાર્યવાહીની યોજના માટેની બ્લૂ જેઝની પ્રતિબદ્ધતાને સન્માનિત કરી જે આખા કેનેડામાં મહામારીને કારણે અપ્રમાણસર અસરગ્રસ્ત થયા હોય એવા લોકોને મદદરૂપ થયા હતા.

સુવાક્યો

"બલ્લેબાજી માટે તૈયાર રહો , બ્રેમ્પટન! જણાવતા આનંદ થાય છે કે ફિલ્ડ ઓફ ડ્રીમ્સ એક્સેસિબલ બેઝબોલ ડાયમંડ હવે સત્તાવાર રીતે બૂકિંગ માટે ખુલ્લુ છે. બ્રેમ્પટનનું પ્રથમ સંપૂર્ણપણે સુલભ બેઝબોલ ડાયમંડને સાકાર કરવામાં મદદરૂપ થવા બદલ અમારા ભાગિદારો પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ અને જેઝ કેર ફાઉન્ડેશનનો અમે આભાર માનીએ છીએ."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"બ્રેમ્પટન એક સ્વસ્થ અને સુરક્ષિત શહેર છે અને અમે બધાને ગમ્મત કરવા, સક્રિય રહેવા અને રમવા માટે નવી જગ્યાઓ અને અવસરો આપતા રોમાંચિત છીએ. ફિલ્ડ ઓફ ડ્રીમ્સ આપણા સમુદાય માટે એક ઉત્તમ ઉમેરો છે જેમાં પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ અને જેઝ કેર ફાઉન્ડેશનનો સહયોગ છે."

- રોવેના સાન્તોસ, રીજનલ કાઉન્સિલર , વોર્ડ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસિસ, સિટી ઓફ બ્રેમ્પટન

"સિટી ઓફ બ્રેમ્પટન, પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ અને જેઝ કેર ફાઉન્ડેશન ગર્વથી રજૂ કરે છે ફિલ્ડ ઓફ ડ્રીમ્સ જે તમામ લોકોને રમવા માટેની સમાવેશી જગ્યા છે. તમામ ક્ષમતાઓ ધરાવતાં બાળકો અને યુવાનો, રહેવાસીઓ, રમતગમતનાં જૂથો, સામુદાયિક સંસ્થાઓ અને કોઈપણ જેમને બેઝબોલ ડાયમંડ પર થોડો સમય જોઈતો હોય તેઓ બ્રેમ્પટન રિક્રિએશનનો સંપર્ક કરીને જગ્યા બુક કરી શકે છે."

- શેરમેન વિલિયમ્સ (Charmaine Williams) સિટી કાઉન્સિલર વોર્ડ 7 અને 8, ઉપ-પ્રમુખ, કમ્યુનિટી સર્વિસિસ, સીટી ઓફ બ્રેમ્પટન

"સિટી ઓફ બ્રેમ્પટન આપણા સમુદાયમાં રોકાણો લાવવા સમર્પિત છે. ફિલ્ડ ઓફ ડ્રીમ્સ એ અમારું સમુદાયના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં મહત્વપૂર્ણ રોકાણ છે અને અમે પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ અને જેઝ કેર ફાઉન્ડેશન ખાતેના અમારા ભાગીદારોનો આભાર માનીએ છીએ."

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર , સિટી ઓફ બ્રેમ્પટન

"પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ અને સિટી ઓફ બ્રેમ્પટન ફિલ્ડ ઓફ ડ્રીમ્સ પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડના સ્વાસ્થ્ય અને સુખાકારીના વિકાસ માટેની સમાવેશી આબોલવાના સર્જન પર ચાલુ રહેલ ફોકસનું અગત્યનું ઉદાહરણ છે. અમે અમારા ભાગિદારો સિટી ઓફ બ્રેમ્પટન અને જેઝ કેર ફાઉન્ડેશન વિના આ કાર્ય કરી નહીં શક્યા હોત. સાથે હળીમળીને સમુદાયનો મહા વિકાસ સંભવ છે તેનું આ જીવંતજગતું ઉદાહરણ છે."

- રશ્મિ સ્વરૂપ, ડાયરેક્ટર ઓફ એડ્યુકેશન, PDSB

"જેઝ કેર ફાઉન્ડેશનને જુડીથ નાયમેન ફિલ્ડ ઓફ ડ્રીમ્સ સાકાર કરવા માટે આવા જોરદાર ભાગીદારો સાથે કાર્ય કરીને ગર્વની લાગણી થાય છે – જે એક સંપૂર્ણપણે સુલભ અને અનન્ય કહી શકાય એવું સીટી ઓફ બ્રમ્પટનનું બેઝબોલ ડાયમંડ છે. અમે ચેલેન્જર બેઝબોલમાં તમામ ક્ષમતાઓ ધરાવતા બાળકો ભેગા મળી શકે, સક્રિય રહી શકે અને તેમના સમુદાયના અન્ય સભ્યો સાથે આનંદ માણી શકે તે માટે એક સમાવેશી અને સલામત જગ્યા પ્રદાન કરતા ઉત્સાહિત છીએ. અમે બન્નેનો આભાર માનીએ છીએ, પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ તેમજ અમારા માનવંતા દાતાઓ જેમના વિના આ પરિયોજના ક્યારેય સાકાર થઈ શકી ન હોત.

- રોબર્ટ વિચેલ (Robert Witchel), એગ્ઝિક્યુટિવ ડાયરેક્ટર, જેઝ કેર ફાઉન્ડેશન (Jays Care Foundation)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca

મલોન એડવર્ડ્સ

મેનેજર ઓફ કમ્યુનિકેશન્સ, પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ

malon.edwards@peelsb.com | (905) 301-

6382

જોઈ કિવન્ટાનિલા

વિશેષજ્ઞ, માર્કેટિંગ એન્ડ કમ્યુનિકેશન્સ, જેઝ કેર ફાઉન્ડેશન

Joey.Quintanilha@bluejays.com